

ગઝલ

મેહુલ એ. ભટ્ટ

.1.

ન આઢીલ થવાયું, ન ઘાયલ થવાયું,
ફક્ત એક ટોળામાં સામીલ થવાયું.

છે દાનતની બાબતમાં હાલત લટકતી,
ન વલ્કલ થવાયું, ન મલમલ થવાયું!

સદા કશ્મકશમાં રહે માંઘલો, દોસ્ત,
ન કાશી થવાયું, ન ચંબલ થવાયું!

ડહાપણનું ટીલું કપાળે કર્યું'તું,
કોઈનીય પાછળ ન પાગલ થવાયું!

સદા એક અફસોસ રહેશે જીવનમાં,
ન 'હા' પાડવામાં મુસલસલ થવાયું!

ભર્યું ત્યાં સુધી તો અધુરા રહ્યા; પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું!

આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય 'મેહુલ' થવાયું?

.2.

થોડુંકેય ક્યાં અંતર છે 'હું ને તું'ની વચ્ચે,
બસ મનના રચેલા સ્તર છે, 'હું ને તું'ની વચ્ચે.

ના એકલો 'હું' કે'ં છે, ના એકલો 'તું' કે'ં છે,
હો 'આપણે' તો બહેતર છે, 'હું ને તું'ની વચ્ચે.

તું ગામ તરફ ખેંચે, હું સીમ તરફ ખેંચું;
સુનસાન પડેલું ઘર છે, 'હું ને તું'ની વચ્ચે.

જળ-થળ-હવા-અગ્ની ને આકાશ મળ્યાં સરખાં,
કઈ બાબતની ટક્કર છે, 'હું ને તું'ની વચ્ચે?

થોડુંક તું ઓળંગે, થોડું હુંય ઓળંગું;
કૈલાસનું ક્યાં શીખર છે, 'હું ને તું'ની વચ્ચે!

.3.

મનખે-મનખે નોખી રામાયણ અહીં,
રામના વેશે મળે રાવણ અહીં!

જાણ પણ થાતી નથી કે શાહુકાર,
કઈ પળે થઈ જાય છે માગણ અહીં!

બે'ક ડગલાં ચાલતાં શીખે અને
રક્ત ભુલી જાય છે ધાવણ અહીં!

એની ઓફરમાં તમે શું ખાટશો?
જળની સાથે ફી મળે છે રણ અહીં!

પી ગયો છે એ કવીતા ઘુંટડો'ક,
ત્યારથી મળતો નથી એ જણ અહીં!

.4.

રાત-દી' - વરસોવરસ - આઠે પ્રહર,
કરગરું છું, યાદ તું આવ્યા ન કર.

મારો સુરજ - મારું ઘર - મારી સફર
છે છતાં મારાં નથી તારા વગર!

વાવ, આજે પણ સજળ છે, છે ભલે;
છાતીમાં રણ ને ઉપર તડકો પ્રખર!

રસ્તા, ચહેરા, ઘર ને તું છે આંખમાં
દીવી, છેટું તો'ય કાં તારું નગર!

દુર લગ રણ, રણ અને રણ છે છતાં;
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

.5.

ટીલાં ભુંસ્યાં, કાઢી માળા,
તોડીને ખોલીશું તાળાં.

ગરજી-ગરજી ગજવે છે, પણ
કેં બોલે ને કરવાવાળા.

આજે મારો, કાલે તારો,
વારાફરતી આવે ગાળા.

સાવ સરળ ઓળખ દ્વેષીની,
દીલ, શબ્દો ને પગલાં કાળાં.

માથું ધોળું, ગાલે ખાડા;
તો પણ ક્યાં ભુલે છે ચાળા!

.6.

સંવાદનો વળી આ તલસાટ કેમ છે?
રસ્તા રઘ્યા નથી, તો હવે વાટ કેમ છે?

વાદળ વગરનું આભ, ન ઠેકાણું વીજનું,
આજે પવનમાં આટલો ઉકળાટ કેમ છે?

મન કલ્પના જ ના કરે, એ ઘાટ તો ઘડ્યા;
તો પાંખ કાપવામાં આ ખચકાટ કેમ છે?

ફાડ્યો છે છેડો ડાળથી માળાએ આજ શું?
પંખીની ચાંચ-પાંખમાં ફફડાટ કેમ છે?

છે ભીંત આસપાસ, ને પાટો છે આંખ પર;
તો આરપાર જોવાનો રઘવાટ કેમ છે?

.7.

ચાલવા માટે અહીં ક્યાં માર્ગ છે?
દોડ-સ્પર્ધાનાં બધે મેદાન છે!

પાટીયાં પણ આવે છે રસ્તા ઉપર,
'ક્યાં જવું છે'નું મગજને ભાન છે?

એ જ કરશે વાત મોટી કોક દી',
જીભ નહીં; પણ જેના મોટા કાન છે.

મારા સંદેશા મહેકે, કેમ કે
ટેરવે મારા મજાનો બાગ છે!

ભીંસ પડતાં શસ્ત્રને છોડી દીધું,
ઓહ! તારો ખુબ મોટો ત્યાગ છે!

.8.

દુનીયા, હું પોતે અને તારો અભાવ-
રોજ દીલ પર ત્રેવડી ચાલે કટાર!

ઓરડે, કાં આંગણે, કાં ગઝલોમાં,
લઈ સમય, તું ક્યાંક તો ક્યારેક આવ!

સ્નેહમાં પણ થાય છે શું ગોલમાલ?
ઉદભવે છે ક્યાંક ને વીકસે છે ક્યાંક!

પાને-પાને ઝુરવાની વાત છે,
વારતામાં ક્યાંય ના આવ્યો વળાંક!

.9.

આ પેન ગોથાં ખાય છે, બેસો ઘડીક વાર;
'મેહુલ', બફાટ થાય છે, બેસો ઘડીક વાર.

ભીતરજી, માંડ માંડ તો આવ્યા છો લાગમાં,
થોડું તરત જવાય છે! બેસો ઘડીક વાર.

હે ઘટનાખોર નયનો, અધીરાં થશો નહીં;
ઘટના હજી બફાય છે, બેસો ઘડીક વાર.

તમનેય રાજી કરવા છે, ખોટાં વખાણથી;
પણ જીભ થોથવાય છે, બેસો ઘડીક વાર.

આમ જ અલપઝલપ તમે આવો ને જાવ તો;
બીજામાં ધ્યાન જાય છે, બેસો ઘડીક વાર.

.10.

સ્વપ્ન પાછળ આયખું ખર્ચી શકું,
ધારું તો હું ઝાંઝવાં પણ પી શકું.

એ ભલે બદલ્યા કરે આબોહવા,
હું અચળ છું, રંગ નૈ બદલી શકું.

આ તો એની આંખ સઘળું બોલે છે,
ના લખ્યું હો' એય હું વાંચી શકું.

લાગણીને બાંધવી જો હોત તો
સાવ કાચા દોરથી બાંધી શકું.

દુશ્મનોને રોજ ક્યાં જઈ શોધવા ?
દોસ્તની પણ આંખમાં ખટકી શકું.

.11.

આંખોની સામે રક્તથી લથબથ કફન હતું,
માનવરુપી એ દૈત્યોનું ધનમાં જ મન હતું !

થઈ છે ખુવારી બેઉ પક્ષે વ્યર્થમાં જ તો,
કોના વીચારે એમનું હસતું વદન હતું?

રસ્તા ઘણા એના સુધી પહોંચી જવા હતા,
પણ એકબીજા સાથે, ક્યાં કે સંકલન હતું?

તપ-ધ્યાન-જપથી ડામતી વખતે જ જ્ઞાન થ્યું,
ઈચ્છાનું ઈચ્છામાં જ તો સાચું શમન હતું!

આવ્યા'તા મળવા તો એ આંખોમાં દમામ લઈ,
તો પાંપણે દડતું'તું એ કોનું નમન હતું?

.12.

જીભ લાંબી ને શ્રવણનાં ટુંકાં લોલ,
વાત કોડીની ને શબ્દો બુઝા લોલ!

પર્વતોનાં ચીત્રો દોરી કાગળે
પામતા સંતોષ મનનાં લુલા લોલ!

સાવ સુકુંભઠ કવીત છે તળ લગી,
રંગથી કીધાં છે લીલાં ઢુંઠાં લોલ!

પેન પર સ્થાપીત કરેલા ભાવભ્રમ,
એક ટપલી સત્યથી થ્યા ભુકા લોલ!

રેશમી ઝભ્મા ને ગંજી ફાટલી,
ભપકા ભારે ને છે ખાલી ગુંજાં લોલ!

મેહુલ એ. ભટ્ટ,

(શ્રવણમંદ બાળકોના શીક્ષક)

૧૨/એ, કીશ્વકૃપા સોસાયટી, પીપળી સામે, મુન્દ્રા રોડ, અંતરજાળ,
આદીપુર(કચ્છ)

Mobile : 94279 76732 / 79840 23870

eMail : bhattma123@gmail.com

FaceBook : <https://www.facebook.com/mehul.bhatt.5>



'સન્ડે ઈ.મહેફીલ'ના આ અંકના અતીથી સમ્પાદકો સુરતના યુવાગઝલકારો ભાઈ
શ્રી ગૌરાંગ ઠાકર – (gaurang_charu@yahoo.com) અને ભાઈ શ્રી સુનીલ શાહ
(sunilshah101@gmail.com)નો ખુબ ખુબ આભાર..



'સન્ડે ઈ.મહેફીલ' – વર્ષ : ચૌદમું – અંક : 403 – June 24, 2018

'ઉંઝાજોડણી'માં અક્ષરાંકન: સુનીલ શાહ - sunilshah101@gmail.com



Have you ever visited : <http://www.gujaratilexicon.com> ?

More than 3,52,03,000 Gujarati Language lovers have visited
<http://www.gujaratilexicon.com>

More than 1,03,80,000 have visited Digital Bhagwadgomandal
<http://www.bhagwadgomandal.com>

More than 10,09,000 have visited Lokkosh
<http://lokkosh.gujaratilexicon.com>

More than 10,07,000 have visited Global-Gujaratilexicon
<http://global.gujaratilexicon.com>

